https://archive.org/details/bk926/page/n0/mode/1up

2010-03-16 -Satpanth Samaj -on Ramesh Vagadiya issue (926)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

(2)

08 2010 9:56AM ASHAPURI SAW MILL MODASA 91 2774 247741 p.2

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ નમો નમઃ

શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ

હેડ ઓફિસ : નવસારી લાટ (પીરાણા), તા. દશક્રોઈ, જી. અમદાવાદ - ૩૮૨૪૨૫ બ્રાન્ચ : નખત્રાણા
(ટ્રસ્ટ રજી. નંબર F ૨૩૮૪ તા. ૧૬-૯-૯૧ અમદાવાદ)

☎ ૦૨૭૧૮ - ૨૮૮૨૨૭ પ્રમુખશ્રી
૦૨૭૧૮ - ૨૮૮૨૨૯ કાર્યાલય

☎ ૦૨૭૧૮ - ૨૮૮૨૨૦ ગુરૂકુલ
૦૨૭૧૮ - ૨૮૮૩૨૦ ગુરૂકુલ

તારીખ : તા. 16/03/2010

પ્રતિશ્રી,

રામજીભાઇ કરમશીભાઇ નાકરાણી

પ્રમુખશ્રી

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજ

નખત્રાણા,

વિષય :-- પાટીદાર સંદેશ માર્ચ 2010ના પ્રમુખશ્રીના નિવેદનના અંનુસંધાનમાં,

માનનિય પ્રમુખ શ્રી

શ્રી કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજની સ્થાપનાના 50 વર્ષ / સુવર્ણ જયંતી મહોત્સવ ઉજ રહ્યા છીએ જેની તડામાર તૈયારીઓ થઇ રહી છે. સમાજના વડીલો સતપંથ સનાતન સમાજના કેટલાક વિવાદાસ્પદ મુદાઓ અંગે સાથે મળીને તેના ઉકેલ માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. બીજી તરફ રમેશભાઇ વાઘડીયા જેવા સમાજના શિક્ષિત વ્યક્તિ હોવા છતાં સતપંથ સમાજની માન હાની તથા ધાર્મિક લાગણીઓ દુભાય તેવી પત્રિકાઓ છાપી વહેચી હતી તેથી મણીભાઇ કે.છાભૈયાએ રમેશભાઇ વાઘડીયા ઉપર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો કેશ અમદાવાદની કોર્ટમાં 2005 ની સાલમાં કરેલ છે. અને હાલ ચાલુ છે. તેમ છતં તાજેતરમાં રમેશભાઇ વાઘડીયા , હિમતભાઇ ખેતાણી,પ્રેમજીભાઇ કેશરાણી, વિગેરે ભાઇઓ સમાજમાં ઠેર ઠે મીટીંગો કરી સતપંથ સમાજની લાગણીઓ દુભાય તેવો વાણીવિલાશ કરી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. સમાજમાં વર્ગ વિગ્રહ થાય તેવું વાતાવરણ સર્જી રહ્યા છે. તેવા માણસોને રોકવા જોઇએ તેની જગ્યાએ સમાજમાં સરપાવ આપતા હોય તેમ કેન્દ્રીય ન્યાય સમિતીમાં સ્થાન આપવામાં આવે છે અને આવી વ્યક્તિ સામે કાયદો કાયદાનું કામ કરે ત્યારે તેમને ખોટા વાણી વિલાસ માટે દિલગીરી દર્શાવી સમાધાન કરવા મા જણાવવાને બદલે સતપંથ સમાજના આગેવાનોને બોલાવી કેશો પાછા ખેચવાનું આપશ્રી તથા કેન્દ્રીય સમાજના આગેવાનો આદેશ આપો તે બીલકુલ વ્યાજબી નથી. આપના આ વહેવારમાં કેન્દ્રીય સમાજ બહુમ સનાતન સમાજના દબાણ હેઠળ પક્ષપાત ભરી નીતી અપનાવી રહ્યો હોય તેમ જણાય છે.

સમાજમાં મિલ્કતની હીફાજત જાળવણી માનહાની વિગેરે હક્કોની જાળવણી બે રીતે થઇ શકે.

(1) બળથી (2) કોર્ટ કાયદાથી. આપણા સમાજમાં બહુમતી સનાતન સમાજ પોતાની બહુમતીના જે

realpatidar.com

https://archive.org/details/bk926/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk926/page/n2/mode/1up

2010-03-16 -Satpanth Samaj -on Ramesh Vagadiya issue (926)

realpatidar.com

(2)

ॐ શ્રી નિષ્કલંકી નારાયણ નમો નમઃ

શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ

હેડ ઓફિસ : નવસારી લાટ (પીરાણા), તા. દશક્રોઈ, જી. અમદાવાદ - ૩૮૨૪૨૫ બ્રાન્ચ : નખત્રાણા

(ટ્રસ્ટ રજી. નંબર F ૨૩૮૪ તા. ૧૬-૯-૯૧ અમદાવાદ)

૦૨૭૧૮ - ૨૮૮૨૨૭ પ્રમુખશ્રી
૦૨૭૧૮ - ૨૮૮૨૨૯ કાર્યાલય

૦૨૭૧૮ - ૨૮૮૨૨૦ ગુરૂકુળ
૦૨૭૧૮ - ૨૮૮૩૨૦ ગુરૂકુળ

તારીખ : તા. 16/03/2010

પ્રતિશ્રી,

રામજીભાઇ કરમશીભાઇ નાકરાણી

પ્રમુખશ્રી

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજ

નખત્રાણા,

વિષય :-- પાટીદાર સંદેશ માર્ચ 2010ના પ્રમુખશ્રીના નિવેદનના અંનુસંધાનમાં,

માનનિય પ્રમુખ શ્રી

શ્રી કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજની સ્થાપનાના 50 વર્ષ / સુવર્ણ જયંતી મહોત્સવ ઉજ રહ્યા છીએ જેની તડામાર તૈયારીઓ થઇ રહી છે. સમાજના વડીલો સતપંથ સનાતન સમાજના કેટલાક વિવાદાસ્પદ મુદાઓ અંગે સાથે મળીને તેના ઉકેલ માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. બીજી તરફ રમેશભાઇ વાઘડીયા જેવા સમાજના શિક્ષિત વ્યક્તિ હોવા છતાં સતપંથ સમાજની માન હાની તથા ધાર્મિક લાગણીઓ દુભાય તેવી પત્રિકાઓ છાપી વહેચી હતી તેથી મણીભાઇ કે.છાભૈયાએ રમેશભાઇ વાઘડીયા ઉપર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો કેશ અમદાવાદની કોર્ટમાં 2005 ની સાલમાં કરેલ છે. અને હાલ ચાલુ છે. તેમ છતાં તાજેતરમાં રમેશભાઇ વાઘડીયા , હિમતભાઇ ખેતાણી,પ્રેમજીભાઇ કેશરાણી, વિગેરે ભાઇઓ સમાજમાં ઠેર ઠે મીટીંગો કરી સતપંથ સમાજની લાગણીઓ દુભાય તેવો વાણીવિલાશ કરી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. સમાજમાં વર્ગ વિગ્રહ થાય તેવું વાતાવરણ સર્જી રહ્યા છે. તેવા માણસોને રોકવા જોઇએ તેની જગ્યાએ સમાજમાં સરપાવ આપતા હોય તેમ કેન્દ્રીય ન્યાય સમિતીમાં સ્થાન આપવામાં આવે છે અને આવી વ્યક્તિ સામે કાયદો કાયદાનું કામ કરે ત્યારે તેમને ખોટા વાણી વિલાસ માટે દિલગીરી દર્શાવી સમાધાન કરવા મા જણાવવાને બદલે સતપંથ સમાજના આગેવાનોને બોલાવી કેશો પાછા ખેચવાનું આપશ્રી તથા કેન્દ્રીય સમાજના આગેવાનો આદેશ આપો તે બીલકુલ વ્યાજબી નથી. આપના આ વહેવારમાં કેન્દ્રીય સમાજ બહુમ સનાતન સમાજના દબાણ હેઠળ પક્ષપાત ભરી નીતી અપનાવી રહ્યો હોય તેમ જણાય છે.

સમાજમાં મિલ્કતની હીફાજત જાળવણી માનહાની વિગેરે હક્કોની જાળવણી બે રીતે થઇ શકે.

(1) બળથી (2) કોર્ટ કાયદાથી. આપણા સમાજમાં બહુમતી સનાતન સમાજ પોતાની બહુમતીના જે

realpatidar.com

https://archive.org/details/bk926/page/n3/mode/1up

realpatidar.com

(3)

08 2010 9:57AM ASHAPURI SAW MILL MODASA 91 2774 247741 p.3

ઉપર સતપંથ સમાજના હક્કો પચાવી પાડે તેમજ સતપંથ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવો વર્તાવ કરે ત્યારે પોતાના હક્કના રક્ષણ માટે તેમજ ધાર્મિક સનમાન જાળવવા માટે બંધારણ મુજબ કાયદા કોર્ટનો સહારો લે તે સ્વભાવિક છે. ખરેખર તો અખિલ ભારતીય કેન્દ્રીય સમાજે પોતાની તટસ્થ ન્યાય સમિતી દ્વારા સતપંથ સનાતન સમાજના કેશોનો ઉંડો અભ્યાસ કરી બંને પક્ષોને ન્યાય મળે ધાર્મિક લાગણીઓના ન દુભાય તેવા ઝડપી પ્રયત્ન કરવા જોઇએ. નહી કે એક તરફી કેશો પાછા ખેચવા એક પક્ષને આદેશ કરાય.

હાલમાં સમાજમાં ચાલતા કોર્ટના કોઇ પણ કેશ સતપંથ સમાજ દ્વારા સનાતન સમાજના હોદેદારો ઉપર કરવામાં આવેલ નથી. જે કોઇ કેશ હાલમાં કોર્ટમાં ચાલુ છે તે સતપંથ સનાતન સમાજની સંયુક્ત મિલ્કતો અંગે થયેલા છે. તો રમેશભાઇ વાઘડીયાનો કેશ તેમના અંગત વાણીવિલાશ સામે ધાર્મિક લાગણી દુભાવાથી મણીભાઇ કે છાભૈયાએ કરેલો છે નહી કે સતપંથ સમાજ, અંગત માનહાની જનક વાણીવિલાશ: તે રમેશભાઇ વાઘડીયાની વ્યક્તિગત હરકત છે. તેને સનાતન સમાજે પોતાની હરકત સમજવાની જરૂર નથી રમેશભાઇ વાઘડીયા એટલે સમગ્ર સનાતન સમાજ તેવું નથી, સનાતન સમાજે રમેશભાઇ વાઘડીયાના કેશને સનાતન સમાજે સમગ્ર સનાતન સમાજનો મુદો ન બનાવવો જોઇએ.

હકિકતમાં રમેશભાઇ વાઘડીયા તેમજ તેમના સાથીદારો સતપંથ સનાતન સમાજ એક થાય તેવું ઇચ્છતાજ નથી અને પોતે શિક્ષિત હોવા છતાં / અગાઉ પોતાની સામે કેશ ચાલુ હોવા છતાં મન ફાવે તેમ વાણીવિલાશ કરે તેમજ સમાજના સમજુ વડીલો સામાજીક એક્તાના પ્રયત્નો કરે તેમને ઉતારી પાડે તેવો વાણી વિલાશ કરે. અને કાયદો કાયદાનું કામ કરે ત્યારે કાયદાનો સામનો કરવાની જગ્યાએ કેન્દ્રીય સમાજ સમક્ષ હમ દર્દી મેળવવા માટે આજીજી કરે અને કેન્દ્રીય સમાજ તેને અનુંમોદન આપે તે બીલકુલ વ્યાજબી નથી. ખરેખર તો આવા અંગત કોર્ટમેટરોને સમાજની મેટર ન બનાવતાં જે તે લોકોને વ્યક્તિગત ધોરણે કોર્ટમેટર ઉકેલવા માટે સ્પષ્ટ જણાવી દેવું જોઇએ.અને સમાજની એક્તાની વાતને આગળ વધારી સુવર્ણ જયંતિ ઉજવવા પ્રત્યે ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

આપણે અખિલ ભારતીય કેન્દ્રીય સમાજની સુવર્ણજયંતી ઉજવી રહ્યા છીએ નહી કે સનાતન સમાજ કે સતપંથ સમાજ ની. આ સુવર્ણજયંતિ મહોત્સવની ઉજવણીમાં કેટલાય સતપંથી ભાઇઓ તનમન ધનથી ખંત પૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે સુવર્ણજયંતિ મહોત્સવ સમિતીના પ્રમુખનું નિવેદન "સતપંથ **સમાજ કોર્ટમાં ચાલતા તમામ કેશો પાછા ખેંચીલે તોજ સુવર્ણ જયંતિ મહોતસ્વમાં ભાગ લઇ શકે"** સમાજની એક્તાની વિરૂધ છે અને બીલકુલ યોગ્ય નથી. કચ્છ કડવા પાટીદાર સમાજના સૌ ભાઇઓ સાંપ્રદાયિક તેમજ અન્ય ભેદભાવ ભુલી એક થઇ આપણી સમાજના આ સુવર્ણજયંતિ મહોતસ્વની ઉજવણીને ભવ્યરીતે સફળતા પૂર્વક પાર પાડીએ એજ શુભેચ્છા.

આ પત્રનો પ્રત્યુતર ની અપેક્ષા સહ, આપનો વિશ્વાસુ

શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ

પ્રમુખ મંત્રી

નકલ રવાના . (1) પ્રમુખશ્રી સુવર્ણજયંતિ મહોતસ્વ

(2) પ્રમુખશ્રી કેન્દ્રીય ન્યાય સમિતી

(3) તંત્રીશ્રી પાટીદાર સંદેશ, ઉમા દર્પણ, પાટીદાર સૌરભ. સતપંથ પ્રકાશન

realpatidar.com